

Date: 15.11.2025

To,  
Gen. Manager (DCS)  
BSE Limited.  
P J Towers, Dalal Street,  
Fort, Mumbai-400001

**SUB: INTIMATION OF ADVERTISEMENT IN NEWSPAPER UNDER REGULATION 47 OF SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS 2015.**

**REF: COMPANY CODE BSE: 523650M/S. YASH INNOVENTURES LIMITED (FORMERLY KNOWN AS REDEX PROTECH LIMITED)**

Dear Sir,


Please find enclosed herewith copy of **Advertisement given in newspaper of unaudited financial results for the quarter and half year ended on 30<sup>th</sup> September 2025** in compliance of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The said financial results were reviewed by Audit committee and approved by the Board of Directors at its meeting held on **Thursday, 13<sup>th</sup> November, 2025**.

You are requested to take the same on your record.

Thanking You.

Yours Sincerely,

**FOR, YASH INNOVENTURES LIMITED  
(FORMERLY KNOWN AS REDEX PROTECH LIMITED)**



**GNANESH RAJENDRABHAIBHAGAT**  
Managing Director  
(DIN:00115076)



Address

Parshwanath Business Park, Corporate House  
No.3, Opp. Prahladnagar Auda Garden,  
Anandnagar Road, Ahmedabad 380015

Website

[www.yashinnoventures.com](http://www.yashinnoventures.com)

Phone

+91 79 2970 0120

# ધીન્સુઝલાઇન

વર્ષ : ૩૨      અંક : ૬૪   તા.૧૪-૧૧-૨૦૨૫    પાનાં ૪   માલિક : જયની પબ્લીશર્સ   તંત્રી : પરેશ ગંજવાલા, સહ તંત્રી : રાધિકા ગંજવાલા

# પરિણામો અપેક્ષા કરતા ઘણા જ જોરદાર

**ગોદરેજ કન્ઝયુમર પ્રોડક્ટ**માં હવે કરેકશન પૂરું થયું હોવાના સંકેત



પરિણામોની સિઝન શરૂ થઈ તેની સરખામણીમાં અત્યારે રોકાણકારો અને એનાલિસ્ટોનો મૂડ ખૂબ જ બુલીશ થઈ ગયો છે અને મોટા ભાગની કંપનીઓના પરિણામો અને મોટા ભાગના સેક્ટરનું પર્ફોમન્સ ખૂબ જ જોરદાર આયું છે. બેંકિંગ સેક્ટર અંગે તો ખૂબ જ અપેક્ષાઓ હતી અને તેમાં નાની અને મોટી તમામ બેંકોએ ખૂબ જ સુંદર આંકડાઓ જાહેર કર્યા છે, પરંતુ સિમેન્ટ, ટેક્ષટાઈલ, રેડીમેઈડ ગાર્મેન્ટ, એફએમસીજી વગેરે તમામ સેક્ટરોમાં અપેક્ષા કરતા વેચાણ વૃદ્ધિ અને નફા જોરદાર આવવાને કારણે હવે બજારનું

સેન્ટીમેન્ટ ખૂબ જ બુલીશ થઈ ગયું છે અને બાકી હતું તો ટોચના એક ફંડ મેનેજરે હવેની દિવાળી સુધીમાં નિફટી ૨૮૦૦૦ના લેવલ સુધી પહોંચી જશે તે સંભાવના વ્યક્ત કરતા તેની પણ બજાર ઉપર ખૂબ જ પોઝિટિવ અસર થઈ છે. સામે પક્ષે અમેરિકામાં ૪૩ દિવસના શટડાઉન પછી વિરોધપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે સમજૂતી થઈ ગઈ છેઅને ૪૩ દિવસ પછી અમેરિકન પ્રમુખે ફર્નિંગ બિલ ઉપર સહીસિક્કા કર્યા છે. અને આ ડેવલપમેન્ટની પણ બજાર ઉપર પોઝિટિવ અસર જોવાઈ અને અમેરિકામાં ફરી એક વખત

## ગામની ગપસપ

- ઈન્ડેક્સ**, બિહારની ચૂંટણીના પરિણામો અને અમેરિકામાં સરકારનું શટડાઉન પૂરું થયું હોવાના સમાચારો ભારતીય બજાર માટે ખૂબ જ પ્રોત્સાહક અને આગામી દિવસોમાં રિલાયન્સ, તાતા સ્ટીલ અને સ્ટેટ બેંકની આગેવાની હેઠળ નિફટી અને સેન્સેક્ષમાં સુંદર ઉછાળાની જગ્યા.
- એશિયન પેઈન્ટ્સ**, બોટમના લેવલથી ભેગા કરવાનું કહ્યું હતું અને શેર અત્યારે રૂા. ૨૮૭૯ ઉપર આવી ગયો છે. રિલાયન્સ જીઓની જેમ બિરલા ઓપસે પણ રિસ્કાઉન્ટ આપીને એશિયન પેઈન્ટને હયામથાવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગોલિયાત એકદમ મજબૂત સાબિત થયો છે અને વેચાણો અને નફાશક્તિમાં સુંદર વૃદ્ધિ, શેર રૂા. ૨૮૭૯ના ભાવે હજી થોડોક સમય જાળવી રખાય. શોર્ટટર્મમાં હજી રૂા. ૧૦૦ના ઉછાળાની જગ્યા.
- ભારતી એરટેલ**, પ-જી નેટવર્કમાં કંપનીની ખૂબ જ સુંદર પ્રગતિ અને શેર અત્યારે રૂા. ૨૦૮૨ ઉપર, મજબૂત તેજીનો પ્રારંભ અને તેથી થોડાક શેરો લઈને મૂકી દેજો. નજીકના સમયગાળામાં પ્રથમ તબક્કે રૂા. ૨૦૦ અને તે પછી બીજા થોડા અઠવાડિયામાં રૂા. ૨૦૦ એમ કુલ રૂા. ૪૦૦નું રિટર્ન છૂટવાની જગ્યા.
- લાસન ઓડ રૂલો**, બીજા ક્વાર્ટરના પરિણામોના એનાલિસિસ સાથે આ શેર લેવાનું કહ્યું હતું અને સુંદર વૃદ્ધિ સાથે રૂા. ૪૦૦૨ ઉપર આવ્યો છે. જાળવી રાખજો. સેન્ચુરીઓ ફટકારતો જશે અને થોડા અઠવાડિયામાં જ રૂા. ૪૪૦૦ના ભાવની સંભાવના મજબૂત છે. અત્યારના ભાવે જોખમ નહિવત.
- સન ફાર્મા**, ઘણા લાંબા સમય પછી આ શેરમાં આકર્ષણ વધ્યું છે. અત્યારના રૂા. ૧૭૩૭ના ભાવે થોડાક શેરો લઈને મૂકી શકાય અને ઉપરમાં રૂા. ૧૮૩૮ના ભાવની ગણતરી, થોડા દિવસોમાં જ રૂા. ૧૦૦ની નોટ આપી શકે.
- એડિસિસ બેંક**, ઘણા સમયથી કોન્સોલિડેશનના તબક્કામાં ફસાયેલો હતો, અને હવે આ શેરમાં ધીમો અપડ્રેન્સ શરૂ થવાના સંકેત, રૂા. ૧૨૨૫ના ભાવે થોડાક શેરો લઈને મૂકી શકાય. રૂા. ૧૨૫૦ ફૂંદાવ્યા પછી આ શેરમાં ઝડપી ઉછાળા સાથે રૂા. ૧૩૦૦ના ભાવની સંભાવના મજબૂત છે.
- એયસીએલ ટેકનોલોજી**, લાંબા સમય પછી આઈટી શેરોમાં સેન્ટીમેન્ટ સુધર્ધુ, અને આ શેરમાં હવે અપડ્રેન્સ શરૂ, રૂા. ૧૫૯૮ ઉપર આવ્યો છે, થોડાક શેરો લઈને મૂકી દેજો અને આવતા થોડા દિવસોમાં રૂા. ૧૬૪૬ અને તે પછીના થોડા દિવસોમાં રૂા. ૧૬૯૬ના ભાવની સંભાવના મજબૂત છે.
- ટ્રેન્ડે**, છેલ્લા ઘણા સમયથી ઘટાડાના તબક્કામાં ફસાયેલો છે. હવે કરેકશન પૂરું થવાની તૈયારી, રૂા. ૪૩૨૬ના ભાવે આ શેરમાં હવે જોખમ નહિવત, રૂા. ૪૨૯૧ના સ્ટોપલોસથી થોડા થોડા શેરો ભેગા કરી શકાય. અપડ્રેન્સ શરૂ થવાની તૈયારી.
- ઈનર્નલ**, આ શેરમાં ગયા અંક વખતે પણ ઘટાડાનો સંકેત આપ્યો હતો અને શેર વધારે તીવ્રતાથી ઘટીને રૂા. ૨૯૭.૭૫ ઉપર આવી ગયો છે. હજી કરેકશન બાકી, નીચામાં એક તબક્કે રૂા. ૨૭૫-૨૮૮ સુધી ઉતરી જાય તેની રાહ જોવી પડે. અને તે પછી મજબૂત નવી જોરદાર તેજીની શરૂઆત થશે. અને તેથી એન્ટ્રી લેવા માટે તૈયાર રહેજો.
- એસીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ**, શેર અત્યારે રૂા. ૧૯૮૮ ઉપર, ઇન્સ્યોરન્સ શેરોમાં અત્યાર સુધી રિટર્ન નહિવત છૂટ્યું છે પરંતુ આ વખતે આ શેરમાં સુંદર રિટર્નની સંભાવના, આગામી દિવસોમાં રૂા. ૨૦૫૦ અને તે પછીના થોડા દિવસોમાં રૂા.૨૦૮૦નો ભાવ જોવા મળી જવાની સંભાવના મજબૂત છે.
- શ્રીરામ ફિનાન્સ**, અત્યારે રૂા. ૮૧૪ ઉપર છે અને વિદેશી કંપની મુકંકને શ્રીરામ ફિનાન્સને હસ્તગત કરવામાં રસ. થોડાક શેરો લઈને મૂકી શકાય. શોર્ટટર્મમાં જ રૂા. ૮૫૦ અને તે પછી રૂા. ૮૮૫નો ભાવ આવી જતા વાર નહિ લાગે.
- રિલાયન્સ ઈન્ફસ્ટ્રીઝ**, રૂા. ૧૫૧૧ના ભાવે શેર હવે તેજીના તબક્કામાં, થોડાક શેરો લઈને મૂકી શકાય. ઉપરમાં રૂા. ૧૫૨૮ થોડા દિવસોમાં જ જોવા મળવાની ગણતરી અને તે પસાર થયા પછી રૂા. ૧૫૪૪નો ભાવ નહીક છે.
- તાતા સ્ટીલ**, પ્રોત્સાહક પરિણામો છતાં પણ આ શેરમાં હજી થોડા દિવસો નબલાઈ અને ટૂંકી વધઘટનો તબક્કો, ભેગા કરવાનો આવો સુંદર મોકો ન છોડતા.

અને અત્યારના તબક્કે કૂંડની માંગની સરખામણીમાં વૈશ્વિક સપ્લાય વધારે હોવાને કારણે નજીકના સમયગાળામાં કૂંડતેલના ભાવમાં એકદમ ઝડપી ઉછાળો આવે તેવી કોઈ સંભાવના નથી લાગતી.

ગયા અઠવાડિયે જાહેર થયેલા અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટના આંકડા મુજબ અમેરિકામાં ૭મી નવેમ્બરે પૂરા થયેલા અઠવાડિયા દરમ્યાન કૂંડતેલનું સ્ટોક ૧૩ લાખ બેરલ વધી ગયું છે અને આ આંકડા આવવાને કારણે વિશ્વના સૌથી મોટા કૂંડ વપરાશકાર દેશ અમેરિકામાં કૂંડની માંગ ઝડપથી નહિ વધે તે સંભાવના પાછળ કૂંડતેલના ભાવમાં ત્રણ સેન્ટનો ઘટાડો જોવાયો હતો. ડબલ્યુટીઆઈ કૂંડ અત્યારે ૫૮.૪૪ ડોલર ઉપર અને બ્રેન્ટ કૂંડ ૬૨.૬૯ ડોલર આસપાસ વધઘટ બતાવે છે. સને ૨૦૨૬ના આખા વર્ષ દરમ્યાન ઓપેકના આંકડા મુજબ જ માંગની સરખામણીમાં સપ્લાય થોડોક વધારે રહેશે અને તે પાસું પણ આગામી દિવસોમાં કૂંડતેલમાં મોટી તેજીની



સરકાર નોર્મલ લેવલ ઉપર કાર્યરત થઈ જતા અમેરિકન શેરબજાર અને વિશ્વભરના શેરબજારોમાં પોઝિટિવ અસર જોવા મળી છે. શટડાઉનને કારણે અમેરિકામાં અનેક પ્રોજેક્ટો અટવાયા હતા અને ખૂબ જ મોટા પાયે કર્મચારીઓને છૂટા થવું પડ્યું હતું, પરંતુ હવે શટડાઉન પૂરું થતા તે પરિસ્થિતિ નોર્મલ થઈ જશે.

સામે પક્ષે બિહારની ચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે. અને નવીદિહલીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ પછી પણ બજારમાં ખાસ કોઈ જ નબળાઈ નથી જોવા મળી. અને તે પાસું પણ પોઝિટિવ કહી શકાય.

સામે પક્ષે ડોલરની સામે રૂપિયો રિઝર્વ બેંકના અશાક પ્રયત્નોને કારણે ૮૮.૬૭ આસપાસ પકડાઈ રહ્યો છે. અને તે રીતે લગભગ ૧૦ ટ્રેડિંગ સેશનથી રૂપિયામાં નવી કોઈ જ નબળાઈ ન જોવા મળતા તેની પણ ેન્ટીમેન્ટ ઉપર ખૂબ જ પોઝિટિવ અસર છે.

સામે પક્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં કૂંડના ભાવમાં પણ ટૂંકી વધઘટનો તબક્કો પકડાઈ રહ્યો છે. અમેરિકામાં સ્ટોક લેવલ વધવાને કારણે કૂંડના ભાવમાં થોડોક ઘટાડો જોવાયો.

## Important Weblinks for Today

https://chanakyanipothi.com/
https://chanakyanipothi.com/ipo-gmp/
https://chanakyanipothi.com/intraday-trading/
https://chanakyanipothi.com/grey-market-premium/
https://chanakyanipothi.com/ipo-subscription-status/
https://chanakyanipothi.com/ipo-allotment-status-how-to-check/
https://chanakyanipothi.com/category/ipo-listing-estimates/
https://chanakyanipothi.com/upcoming-ipos-2025/
https://sahifund.com/
https://sahifund.com/sip/
1) https://sahifund.com/whiteoak-capital-large-cap-fund/
2) https://sahifund.com/latest-new-fund-offers/
3) https://sahifund.com/dsp-multi-asset-allocation-fund/
4) https://sahifund.com/icici-prudential-flexicap-fund/
5) Sahifund bottom
https://chanakyanipothi.com/best-stock-to-buy-today/
https://chanakyanipothi.com/news-crux/
https://chanakyanipothi.com/fii-data-today/
https://sahifund.com/fii-dii-buy-sell-activity/
https://chanakyanipothi.com/chanakya-niti/
https://chanakyanipothi.com/fujiyama-power-systems-ipo/
https://chanakyanipothi.com/tenneco-clean-air-ipo-date-price-gmp-review-details/
https://chanakyanipothi.com/physicswallah-ipo-date-review-price-allotment-details/
https://chanakyanipothi.com/emmvee-photovoltaic-ipo-date-review-price-allotment-details/
https://chanakyanipothi.com/pine-labs-ipo-date-review-price-allotment-details/
https://chanakyanipothi.com/sme-ipo-watch/workmates-core2cloud-ipo/
https://chanakyanipothi.com/sme-ipo-watch/mahamaya-lifesciences-ipo/
https://chanakyanipothi.com/sme-ipo-watch/shining-tools-ipo/
https://sahifund.com/canara-robeco-consumer-trends-fund/
https://chanakyanipothi.com/sme-ipo-watch/curis-lifesciences-ipo/
https://sahifund.com/groww-nifty-midcap-150-etf-growth/
https://sahifund.com/360-one-focused-fund/
https://sahifund.com/aditya-birla-sun-life-nifty-bank-etf/
https://chanakyanipothi.com/stock-market-today-by-vaishali-parekh/
https://chanakyanipothi.com/technical-analysis-of-the-market-by-nagaraj-shetti/
https://chanakyanipothi.com/reliance-share-price-target-strategy-today/
https://chanakyanipothi.com/winning-strategy-for-gold-trading-tomorrow/
https://chanakyanipothi.com/rupee-dollar-exchange-rate-guidance/
https://chanakyanipothi.com/chanakya-community/

સંભાવના ન હોવાનું દર્શાવે છે. આમ આ તમામ પાસાઓને કારણે આગામી દિવસોમાં અને ખાસ કરીને જ્યારે રાજા, રાણી અને વડીર (તાતા સ્ટીલ, રિલાયન્સ અને સ્ટેટ બેંક) તેજીમાં હોવાને કારણે એકંદરે બજાર ધીરે ધીરે સુધરતું જશે તે સંભાવના મજબૂત છે.

એફએમસીજી કંપનીઓમાં એકંદરે પરિણામો અપેક્ષા કરતા ઘણા જ સુંદર આવ્યા છે. અને હવે સારા ચોમાસાની અસર પણ આ કંપનીઓની માંગ ઉપર સ્પષ્ટ રીતે જોઈ શકાયે. અને તેથી એફએમસીજી શેરોમાં નીચા મથાળેથી નવી લેવાલી નીકળે તે સંભાવના છે.

દેશની ટોચની એફએમસીજી કંપની **હિન્ડુસ્તાન યુનિલિવર**નો શેર પણ હવે કરેકશન પૂરું કરીને ધીરે ધીરે સુધારાતરફી થવાની સંભાવના છે. અત્યારે રૂા. ૨૪૪૪ ઉપર છે અનએ ૫૩.૮૦નો પીઈરિશિયો દર્શાવે છે. અને આ શેરમાં પણ આવતા થોડા દિવસો દરમ્યાન કરેકશન પૂરું થાય અને શેર અપડ્રેન્સમાં દાખલ થાય તેવી ગણતરી છે. રૂા. ૨૪૦૦નો સ્ટોપલોસ રાખીને થોડા થોડા કરીને શેરો ભેગા કરી શકાય અને શોર્ટટર્મમાં રૂા. ૨૪૪૪ અને તે પછી રૂા. ૨૪૬૨નો ભાવ જોવા મળવાની ગણતરી છે અને એક વખત આ શેરમાં રૂા. ૨૫૦૦નું લેવલ પસાર થાય તે પછી તેજી ઝડપી બનશે અને તેથી આ શેરને ખાસ ધ્યાનમાં રાખવો. હિન્દુસ્તાન યુનિલિવર ૧૦૧ ટકાનું ડિવિડન્ડ પેઆઉટ ધરાવતી હોવાને કારણે તેની પોઝિટિવ અસર આ શેર ઉપર જોઈ શકાયે.

**ગોદરેજ કન્ઝયુમર પ્રોડક્ટ**નો શેર અત્યારે રૂા. ૧૧૩૧ ઉપર છે અને આ શેરમાં પણ હવે કરેકશન પૂરું થયું હોવાના સંકેત મળ્યા છે. તાજેતરમાં જ રૂા.૧૧૦૦ના લેવલથી આ શેરમાં બોટમઆઉટ થઈને અત્યારે રૂા. ૧૧૩૧નો ભાવ આવ્યો છે, ગોદરેજ કન્ઝયુમર અત્યારે ૬૧ના પીઈરિશિયો ઉપર મળી રહ્યો છે અને સપ્ટેમ્બર ક્વાર્ટર દરમ્યાન તેના નફામાં ૨.૮૬ ટકાનો ઘટાડો થયો હતો અને તે પછી હવે વધારે પ્રોત્સાહક પરિણામો જાહેર થવાની સંભાવના છે.

તે જ પ્રકારે **કોલગેટ પામોલેવ**માં પણ હવે કરેકશન પૂરું થાય અને ધીરે ધીરે ભાવ સુધરવાનું શરૂ થાય તેવા સંકેત છે. રૂા. ૨૫૦૦ના લેવલથી કોલગેટમાં કરેકશન શરૂ થયું હતું અને ગયા અઠવાડિયે રૂા. ૨૧૫૧ ઉપર બોટમ બન્યું અને અત્યારે કોલગેટનો શેર રૂા. ૨૧૭૦ ઉપર આવ્યો છે. કેવળ ૪૪નો પીઈરિશિયો છે અને આ પાસું ધ્યાનમાં રાખીને થોડું થોડું રોકાણ કરી શકાય. કોલગેટ પણ સ્વાભાવિક છે કે મલ્ટીનેશનલની જેમ દેવાનો કોઈ બોજો નથી ધરાવતી અને ઇક્વીટી ઉપર ૭૨.૪૦ ટકાનું સુંદર રિટર્ન આપ્યું છે. આ કંપની પણ ૧૦૬ ટકા ડિવિડન્ડ પેઆઉટ રેશિયો ધરાવે છે અને આ તમામ પાસાઓને કારણે આ શેરમાં પણ લેવ્યુબાઈંગ નીકળવાની સંભાવના મજબૂત છે.

સામે પક્ષે **ગુલેટો**નો શેર છેલ્લા ઘણા સમયથી કરેકશનમાં ફસાયો હતો. શેવિંગ બ્લેડના ઉત્પાદનમાં જીલેટ અત્યારે મોનોપોલી ઉપર છે તેમ કહીએ તો પણ સહેજ અતિશયોક્તિ નથી. રૂા. ૧૧૫૦૦ના ભાવન અઠવાડિયાના ટોપની સામે અત્યારે રૂા. ૮૫૦૦ ઉપર આવ્યો છે અને હજી કરેકશનના છેલ્લા તબક્કા પછી આ શેરમાં જોરદાર તેજીની જગ્યા છે. આ શેર માટે રૂા. ૮૩૦૦નો સ્ટોપલોસ રાખીને તેમાં ધીરે ધીરે શેર ભેગા કરી શકાય. મોનોપોલી બિઝનેસ ધરાવતી કંપની છે અને તેથી અન્ય કોઈ ચિંતા નથી. મલ્ટીનેશનલ કંપની હોવાને કારણે તેમાં દેવાનો કોઈ જ બોજો ન હોય તે પણ સ્વાભાવિક છે અને છેલ્લા ત્રણ વર્ષથી ઇક્વીટી ઉપર ૩૮.૬૦ ટકાનું રિટર્ન આપ્યું છે અને તેથી અત્યારે તમે રૂા. ૮૪૦૦ના ભાવે

દાખલ થાવ છો તેમ માનીએ તો ઉપરમાં તમને ૧૨ મહિને લગભગ ૩૬થી ૪૦ ટકા રિટર્ન છૂટવાની જગ્યા છે અને બીજી કોઈ રીતે ચિંતાનું કારણ નથી અને તથી થોડાક શેર લઈને મૂકી શકાય.

તેવી જ રીતે **પ્રોક્ટર એન્ડ ગેબલ હેલ્થ એન્ડ હાઇજીન**માં પણ શેર રૂા. ૧૬૨૫૦ના ટોપથી ઘટીને અત્યારે રૂા. ૧૨૯૬૮ ઉપર આવી ગયો છે અને આ શેરમાં પણ રૂા. ૧૨૫૦૦ આસપાસ બોટમ બને તે સંભાવના છે. અને તેથી આ અંક આવે ત્યારે આ શેરને પણ તમે ઇન્વેસ્ટમેન્ટ માટે ધ્યાનમાં રાખજો. રૂા. ૧૨૫૦૦ આસપાસ તમે કવર કરો તો ઉપરમાં લગભગ તમને ૩૦થી ૩૫ રિટર્ન એક વર્ષમાં છૂટશે તે સંભાવના છે અને આ શેરમાં પણ અન્ય કોઈ નેગેટીવ પાસું ન હોવાથી શેર લઈને એક વર્ષ માટે શાંતિપૂર્વક ઊંધી જવું.

આવો જ સુંદર ઉછાળો આગામી દિવસોમાં **કાભરના** શેરમાં પણ દેખાય છે. ડાબરનો શેર ભાવન અઠવાડિયાના રૂા. ૫૭૭થી ઘટીને રૂા. ૫૨૦

આસપાસ ચાલે છે. રૂા. ૪૮૦ના લેવલે બોટમ બન્યું હતું અને તે પછી તેણે લગભગ ૪૦-૪૨નો ઉછાળો આપી દીધો અને હવે આ શેર મજબૂત અપડ્રેન્ડમાં દાખલ થયો છે અને તેથી રૂા. ૫૨૨ના ભાવે લગભગ ચારથી છ મહિના માટે દાખલ થનારને ૧૦થી ૧૨ ટકા રિટર્નની જગ્યા છે. ઉપરમાં રૂા. ૫૭૫ આસપાસનો ભાવ જોવા મળે તો સહેજ પણ નવાઈ નહિ લાગે.

શોર્ટટર્મ ખેલાડીઓનું આકર્ષણ **ઈમામીના** શેરમાં પણ વધ્યું છે. ઈમામીમાં પણ ગયા અઠવાડિયે રૂા. ૫૦૦નું બોટમ બન્યું હતું અનેતે પછી હજી આ શેરમાં ઘટાડો આગળ વધે છે કે કેમ તે સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે અને તેથી તરત જ એન્ટ્રી લેવાને બદલે લગભગ ૮થી૧૦ દિવસ આ શેરની ચાલનો અભ્યાસ કર્યા પછી જો ખરેખર બોટમ બન્યું હોય અને ઉપરમાં આ શેર રૂા. ૫૪૦-૫૪૫નું લેવલ ફૂંદાવી શકે તો તેમાં એન્ટ્રી લઈ શકાય. જો આ શેર અત્યારના રૂા. ૫૨૩ના લેવલથી વધારે તુટે તો કરેકશન પૂરું થાય તેની રાહ કલર કોસ્મેટિક પણ લોન્ચ કરવામાં જોવી વધારે ફાયદાકારક રહેશે.

એફએમસીજી અને ઓનલાઈન બિઝનેસ આ બંનેનું કોમ્બિનેશન ધરાવતો **હોનાશા કન્ઝયુમર**નો શેર ખાસ ધ્યાનમાં લેવાય. ઓનલાઈન અને ઈ-કોમર્સ શેર અંગે અમે ખૂબ જ બુલીશ છીએ તેમ તમે જાણો છે અને અગાઉ પણ હોનાસાના પકડવાનું કહ્યું હતું. અત્યારે વધીને રૂા. ૨૮૨-૨૮૬ વચ્ચે આવી ગયો છે અને ગયા અઠવાડિયે કંપનીએ ખૂબ જ સુંદર પરિણામો જાહેર કર્યા. હોનાસાની ખાસિયત એ છે કે આ કંપની ભારતની સૌથી મોટી ડિજિટલ ફર્સ્ટ બ્યુટિ અને પર્સનલકેર પ્રોડક્ટ છે અને તેની મામા અર્થ બ્રાન્ડ સ્કીનકેરમાં ભારતની ત્રીજા નંબરની સૌથી મોટા બ્રાન્ડ બની ચૂકે છે અને મામા અર્થ બ્રાન્ડ હેઠળ તેણે ફેસવોશ, સિરમ અને સનસ્ક્રીન લોશન તેમજ હેરકેર માટે અને બોડીકેર માટે અનેક પ્રોડક્ટો પણ લોન્ચ કરી છે. મામા અર્થ બ્રાન્ડના બેબી અને કિડ્ઝ વેર પણ ખૂબ જ પોપ્યુલર બની ચૂક્યા છે. અને આ કંપની દ્વારા કલર કોસ્મેટિક પણ લોન્ચ કરવામાં

<p><b>Yash Innoventures Limited</b></p> <p><b>(CIN: L45100GJ1991PLC016557)</b></p> <p><b>(Formerly known as Redex Protech Limited)</b></p> <p><b>Registered Office:</b> 1 Floor, Corporate House No.3, Parshwanath Business Park, Behind Prahladnagar Garden, S G Highway, Ahmedabad-380014, Gujarat, India.</p> <p><b>STATEMENT OF UNAUDITED FINANCIAL RESULT OF THE QUATRTER ENDED ON 30<sup>TH</sup> SEPTEMBER,2025</b></p> <p><b>The board of directors of the company, at the meeting held on 13<sup>th</sup> November,2025 approved the unaudited financial result for the quarter ended on 30<sup>th</sup> September,2025.</b></p> <p><b>The result along with the Auditor's Report, have been posted on company's website at</b></p> <p><b><a href="https://yashinnoventures.com/documents/FR-Sep-25.pdf">https://yashinnoventures.com/documents/FR-Sep-25.pdf</a>.</b></p> <p><b>and can be accessed by scanning the QR Code.</b></p> <p><b>For Yash Innoventures Limited (Formerly known as Redex Protech Limited) SD/-</b></p> <p><b>Place: Ahmedabad</b>  <b>Date : 13/11/2025</b></p> <p><b>Mr. Gnanesh Rajendrabhai Bhagat</b>  <b>Managing Director</b>  <b>DIN - 00115076</b></p> <p><b>Note:</b> The above intimation is in accordance with Regulation 33 read with Regulation 47(1) of the SEBI (Listing Obligation &amp; Disclosure Requirements) Regulations, 2015.</p>	
---	--

SHAH FOODS LIMITED						
CIN : L15419 GJ 1982 PLC 005071						
Regd. Office : Kalol Mehsana Highway, PO-Chhatral, Tal.-Kalol, Dist.-Gandhinagar-382729						
Telephone 079 26448371 , 02764233931 email : shahfoods.ahmedabad@gmail.com						
Statement of Standalone Unaudited Financial Results for the Quarter Ended 30.09.2025 (Rs. in lakhs)						
SR No.	PARTICULARS	Three Months ended			Half Yearly	
		30.09.2025	30.06.2025	30.09.2024	30.09.2025	31.03.2025
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income From Operations (net)	0	-	88.59	0	96.59
2	Net Profit/(Loss) for ordinary activities (before Tax, Exceptional and/or Extraordinary Items)	(0.66)	(5.19)	2.55	(5.85)	(4.38)
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(0.66)	(5.19)	2.55	(5.85)	(4.38)
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(0.66)	(5.19)	2.55	(5.85)	(4.38)
5	Total Comprehensive Income for the Period (Comprising Profit/Loss for the period (After Tax) and Other Comprehensive Income (After Tax))	(0.66)	(5.19)	2.55	(5.85)	(4.38)
6	Equity Share Capital.(face value of Rs.10 each)	59.75	59.75	59.75	59.75	59.75
7	Reserves (excluding Revaluation Reserve) as shown in balance Sheet of previous					(116.17)
8	Earning Per Share (before extraordinary items) of Rs.10 /- each	(0.11)	(0.87)	0.43	(0.98)	(0.73)
9	Earning Per Share (after extraordinary items) of Rs.10 /- each	(0.11)	(0.87)	0.43	(0.98)	(0.73)
	Basic Diluted	(0.11)	(0.87)	0.43	(0.98)	(0.73)
	Basic Diluted	(0.11)	(0.87)	0.43	(0.98)	(0.73)

**Notes :**  
1. The above Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its Meeting held on 14th November, 2025. The statutory auditors have carried out a limited review of the results for the quarter ended September 30, 2025 and have expressed an unqualified audit opinion.  
2. The figures for the previous period/year have been regrouped /reclassified , wherever necessary.  
3. 'This Statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules,2015 (Ind As), prescribed under section 133 of the Companies Act, 2013, and other recognized accounting practices and policies to the extent applicable.  
4. The Disclosure is as per Regulation 33 of SEBI (Listing Obligations & Discloser Requirements) Regulations, 2015.  
5.The Company is operating in single segment, so above results are for single segment only.

**For and on behalf of the Board of Directors**  
**For, Shah Foods Limited**  
**Sd /-**  
**HEMAKSHI MANAN PATEL**  
**Director**  
**DIN : 07297442**

### Hindustan Aeronautics revamp study to be ready by March next year

A study on reorganising state-run Hindustan Aeronautics Ltd (HAL) will be ready by March next year, with the government engaging Boston Consulting Group (BCG) for the purpose, defence sources told.

The move comes in light of the company's growing order book and is focused on platform delivery as well as meeting customer requirements, they added.

HAL's confirmed contracts pending or under execution stand at around Rs.2.52 trillion.

Not only is HAL India's largest defence firm by revenue, order book, and market capitalisation, it is also the country's only combat aircraft manufacturer at present.

Apart from decades of licence manufacturing foreign-designed platforms like the MiG-21 and Su-30MKI, it is also producing the indigenous light combat aircraft Tejas and handling regular repair and overhaul orders.

It has also designed and manufactured a range of military and civil helicopter variants.

"BCG was brought in during September to study ways to reorganise HAL," said one of the sources. They added that the move was initiated by the Ministry of Defence's Department of Defence Production, which oversees all of the country's 16 defence public sector undertakings (DPSUs), including HAL.

The source added that BCG has been given until March 2026 to submit its study.

The proposed reorganisation aims to improve HAL's platform delivery efficiency, sharpen its product focus, and enhance customer responsiveness, the sources said.

In what could be the first substantive challenge to its monopoly in combat aircraft manufacturing, HAL is competing with a clutch of private-sector contenders to qualify for building prototypes of the Advanced Medium Combat Aircraft (Amca).

However, its expansive order book has proved to be a challenge, with one of the criteria in the expression of interest issued by the Aeronautical Development Agency, the Amca's design

agency, stipulating that companies would receive zero marks out of 100 if their order book was three times their turnover.

HAL's order book is over eight times its FY25 turnover of Rs.30,105 crore. Its FY25 order book alone accounted for 37.14 per cent of the combined value held by all nine original, or 'old', DPSUs, according to the Standing Committee on Defence's March 2025 report.

The seven 'new' DPSUs were created in October 2021 through the corporatisation of the Ordnance Factory Board.

HAL is yet to begin deliveries of the 83 Tejas Mark-1A (Mk1A) jets, contracted for Rs.36,400 crore in February 2021, to the Indian Air Force.

It is also executing a Rs.62,700-crore order placed in March 2025 for 156 Prachand Light Combat Helicopters.

In September, HAL received a follow-on order for a second tranche comprising 97 Mk1A aircraft at a cost exceeding Rs.62,370 crore.

Deliveries are expected to begin in 2027–28 and conclude over six years.

### Jaguar Land Rover cyberattack hit TaMo PV Q2 showing; FY26 outlook cut

Tata Motors Passenger Vehicles (TMPV) on Friday reported a 13 per cent year-on-year (Y-o-Y) decline in consolidated revenue from operations for the second quarter of 2025-26 (FY26 Q2), largely due to the late-August cyberattack on its subsidiary Jaguar Land Rover (JLR) that forced a shutdown of its manufacturing operations for over five weeks.

This is TMPV's first results announcement since its demerger from the commercial vehicles business earlier this month.

The inclusion of a notional profit of Rs 82,616 crore from the "disposal of discontinued operations" (demerger of commercial vehicles business) resulted in the consolidated net profit rising to Rs 76,248 crore in the second quarter. Before this inclusion, the company incurred a loss of Rs 6,368 crore in this quarter.

JLR's revenue for the quarter declined 24 per cent Y-o-Y, while its revenue for the first half of FY26 declined 16.3 per cent Y-o-Y. This was mainly due to the cyber incident and planned phase-out of legacy

Passenger Vehicles. Our agile approach, strong portfolio and impactful marketing helped us drive this growth trajectory. With a robust booking pipeline and rising consumer confidence, we are poised to sustain this momentum in H2 FY26, guided by our several new launches ahead."

The passenger vehicle segment saw double-digit year-on-year growth in wholesale volumes and registrations, supported by Tata Motors' multi-powertrain portfolio, with CNG and EVs together contributing 45 per cent of total volumes. EV sales jumped nearly 60 per cent Y-o-Y to around 25,000 units. A reinvigorated demand environment also drove record sales of 60,000 units in September, helping improve revenues and deliver sequential gains in profitability.

Chandra described September and October as "blockbuster months", each crossing the 60,000-unit mark and helping Tata secure the number two OEM position in the market.

Inventory levels remain healthy at 27 days, with plans



Jaguar models ahead of the "new Jaguar launch". From 2026, Jaguar will become an electric vehicle-only brand.

The profit of JLR was dragged down not just because of the cyber incident but also due to the ongoing impact of US tariffs, as well as reduced volume sales.

In light of the challenges faced, JLR has revised its FY26 earnings before interest and taxes (EBIT) guidance to 0–2 per cent.

PB Balaji, chief financial officer of the entire Tata Motors Group, said, "It has been a difficult period for the business. However, we are committed to emerging from the cyber incident even stronger. The demand situation remains challenging globally, but domestically there are signs of resurgence."

However, passenger vehicle and electric vehicle volume sales of the Indian arm stood at 144,500 units, rising 10.8 per cent Y-o-Y on the back of robust festive demand, reduction in GST rates and strong traction of the new model launches.

Revenue was also up 15 per cent Y-o-Y at Rs 13,500 crore in Q2, while H1FY26 revenue increased 3.6 per cent Y-o-Y to Rs 24,400 crore.

Shailesh Chandra, managing director and CEO, Tata Motors Passenger Vehicles, said,

"Q2 FY26 was a landmark quarter for Tata Motors

to bring them down further.

Looking ahead, Tata Motors expects its upcoming quarters to be strong, backed by robust festive bookings, upcoming launches such as the Sierra EV, and sustained momentum through the second half.

Nexon was the number one model in India across both September and October. Tata also recorded its highest-ever Harrier and Safari volumes.

"We remain very optimistic about the business in India, and fully geared up to deliver a very strong second half of FY26. We anticipate healthy demand momentum for the Indian EV industry on the back of reduced GST," Chandra added.

The company's performance was also impacted due to weaker demand in China.

Due to the cyber incident and US tariff pressures, the company sharply cut its FY26 guidance, lowering its EBIT margin and projecting a free cash outflow of £2.2–2.5 billion, while indicating that JLR is expected to see a better H2 than H1 as production normalises.

Tata is also strengthening cybersecurity and rebuilding its systems, acknowledging that "a lot of work is currently happening in real time to harden our external interfaces".

"We believe we have already done that and are also standing up strengthened systems as we speak," Balaji added.

### Adani Group to invest Rs 1 trn in Andhra Pradesh over next decade

Adani Group said on Friday it will invest around Rs 1 trillion in various sectors of Andhra Pradesh over the next ten years, deepening its commitment in the state where it will partner with Google for an artificial intelligence (AI) hub in Visakhapatnam.

jointly organised by the Andhra Pradesh government and the Confederation of Indian Industry (CII), in Visakhapatnam.

Google will invest \$15 billion over five years in setting up an AI hub, which will include the country's largest data centre, in partnership with Adani Group. It will be Google's largest such hub outside the US.

Adani called Andhra Pradesh Chief Minister Chandrababu Naidu a visionary who had "rewritten the playbook of modern industrial India".

He said state IT minister

Nara Lokesh is "agile, data-driven, deeply humane," and whose focus on skilling, digital infrastructure, and new-age industries is making Andhra Pradesh "India's fastest-moving startup state".

"The flagship of our commitment is the Vizag tech park. We are building one of the world's largest centres in partnership with Google. This is a combined \$15 billion vision of sustainable and hi-tech growth. Our operations created several direct and indirect jobs. We will match your skill, scale and spirit. We commit to become the largest investor in Andhra Pradesh's bright future," he said.

### Yash Innoventures Limited (CIN: L45100GJ1991PLC016557) (Formerly known as Redex Protech Limited)

Registered Office: 1 Floor, Corporate House No.3, Parshwanath Business Park, Behind Prahladnagar Garden, S G Highway, Ahmedabad-380014, Gujarat, India.

#### STATEMENT OF UNAUDITED FINANCIAL RESULT OF THE QUATRTER ENDED ON 30<sup>TH</sup> SEPTEMBER,2025

The board of directors of the company, at the meeting held on 13<sup>th</sup> November,2025 approved the unaudited financial result for the quarter ended on 30<sup>th</sup> September,2025.

The result along with the Auditor's Report, have been posted on company's website at

<https://yashinnoventures.com/documents/FR-Sep-25.pdf>.

and can be accessed by scanning the QR Code.



For Yash Innoventures Limited (Formerly known as Redex Protech Limited) SD/-

Mr. Gnanesh Rajendrabhai Bhagat Managing Director DIN - 00115076

Place: Ahmedabad Date : 13/11/2025

Note: The above intimation is in accordance with Regulation 33 read with Regulation 47(1) of the SEBI (Listing Obligation & Disclosure Requirements) Regulations, 2015.

### SHAH FOODS LIMITED

CIN : L15419 GJ 1982 PLC 005071  
Regd. Office : Kalol Mehsana Highway, PO-Chhatral, Tal.-Kalol, Dist.-Gandhinagar-382729  
Telephone 079 26448371 , 02764233931 email : shahfoods.ahmedabad@gmail.com  
Statement of Standalone Unaudited Financial Results for the Quarter Ended 30.09.2025  
(Rs. in lakhs)

SR No.	PARTICULARS	Three Months ended			Half Yearly		Year
		30.09.2025	30.06.2025	30.09.2024	30.09.2025	30.09.2024	Ended 31.03.2025
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income From Operations (net)	0	-	88.59	0	96.59	378.22
2	Net Profit/(Loss) for ordinary activities (before Tax, Exceptional and/or Extraordinary Items)	(0.66)	(5.19)	2.55	(5.85)	(4.38)	10.80
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(0.66)	(5.19)	2.55	(5.85)	(4.38)	10.80
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(0.66)	(5.19)	2.55	(5.85)	(4.38)	10.80
5	Total Comprehensive Income for the Period (Comprising Profit/Loss for the period (After Tax) and Other Comprehensive Income (After Tax))	(0.66)	(5.19)	2.55	(5.85)	(4.38)	10.80
6	Equity Share Capital.(face value of Rs.10 each)	59.75	59.75	59.75	59.75	59.75	59.75
7	Reserves (excluding Revaluation Reserve) as shown in balance Sheet of previous						(116.17)
8	Earning Per Share (before extraordinary items) of Rs.10 /- each	(0.11)	(0.87)	0.43	(0.98)	(0.73)	1.81
9	Earning Per Share (after extraordinary items) of Rs.10 /- each	(0.11)	(0.87)	0.43	(0.98)	(0.73)	1.81
	Basic	(0.11)	(0.87)	0.43	(0.98)	(0.73)	1.81
	Diluted	(0.11)	(0.87)	0.43	(0.98)	(0.73)	1.81

#### Notes :

- The above Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its Meeting held on 14th November, 2025. The statutory auditors have carried out a limited review of the results for the quarter ended September 30, 2025 and have expressed an unqualified audit opinion.
- The figures for the previous period/year have been regrouped /reclassified , wherever necessary.
- This Statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules,2015 (Ind As), prescribed under section 133 of the Companies Act, 2013, and other recognized accounting practices and policies to the extent applicable.
- The Disclosure is as per Regulation 33 of SEBI (Listing Obligations & Discloser Requirements) Regulations, 2015.
- The Company is operating in single segment, so above results are for single segment only.

For and on behalf of the Board of Directors  
For, Shah Foods Limited  
Sd /-  
HEMAKSHI MANAN PATEL  
Director  
DIN : 07297442

Place: Ahmedabad Date : 14-11-2025

### IHCL to acquire 51% stake in wellness brand Atmantan for Rs.240 crore

Indian Hotels Company Ltd (IHCL), the parent of Taj hotels, on Friday announced that it will acquire a controlling stake of 51 per cent in Sparsh Infratech Private Ltd, which operates Atmantan wellness resort in Maharashtra, for Rs.240 crore.

The move marks IHCL's entry into the integrated wellness space. Located in Mulshi near Pune, Atmantan is a leading integrated wellness destination. Spread over 36 acres, the 97-key luxury centre offers transformative programmes rooted in ayurveda, yoga, Indian naturopathy, physiotherapy, nutrition, counselling, coaching, and fitness.

The transaction will entail primary investment of Rs.205 crore and a secondary share purchase of Rs.35 crore. The enterprise value of the target company for the transaction is estimated at Rs.415 crore. The company recorded a revenue of Rs.76.7 crore in 2025-26 (FY25).

"The growing wellness tourism market is witnessing a



growing competition in the space helps us. We are continuously identifying white spaces, and finding the right partnerships to fill those, in line with our 2030 strategy," Puneet Chhatwal, managing director and chief executive officer (MD&CEO), IHCL, told.

IHCL's "Accelerate 2030" strategy includes plans to reach a portfolio of 700 hotels by 2030, and doubling its consolidated revenue to Rs.15,000 crore.

"This is a niche business

where quality is far more important than quantity. As we learn more, we can have five to ten such assets in the coming five years," Chhatwal added.

The move also opens cross-selling opportunities with IHCL's own wellness-focused brand J Wellness Circle.

"India has a rich tradition of old medical systems. The healing that we do is deeper and has more visible effects.

We always wanted to expand more, and by joining hands with IHCL, we can develop world-class healing centres in new destinations," said Nikhil Kapur, founder-director, Atmantan Wellness Centre.

"We look forward to integration with IHCL's membership and loyalty programme, which will open up a lot many opportunities for us in all parts of the country and overseas as well," he further said, adding that the brand will be expanding to Hyderabad with a 100-odd key property by 2028-29, and also to Kerala.

#### Today's Important Weblinks:

<https://chanakyanipothi.com/>  
<https://chanakyanipothi.com/grey-market-premium-latest-ipo-gmp/>  
<https://chanakyanipothi.com/ipo-subscription-status/>  
<https://chanakyanipothi.com/ipo-allotment-status-how-to-check/>  
<https://chanakyanipothi.com/category/ipo-listing-estimates/>  
<https://chanakyanipothi.com/upcoming-ipos-2025/>  
<https://sahifund.com/>  
1) <https://sahifund.com/whiteoak-capital-large-cap-fund/>  
2) <https://sahifund.com/latest-new-fund-offers/>  
3) <https://sahifund.com/dsp-multi-asset-allocation-fund/>  
4) <https://sahifund.com/icici-prudential-flexicap-fund/>  
5) Sahifund bottom  
<https://chanakyanipothi.com/best-stock-to-buy-today/>  
<https://chanakyanipothi.com/news-crx/>  
<https://chanakyanipothi.com/fii-data-today/>  
<https://sahifund.com/fii-dii-buy-sell-activity/>  
<https://chanakyanipothi.com/chanakya-niti/>  
<https://chanakyanipothi.com/stock-market-today-by-vaishali-parekh/>  
<https://chanakyanipothi.com/technical-analysis-of-the-market-by-nagaraj-shetti/>  
<https://chanakyanipothi.com/reliance-share-price-target-strategy-today/>  
<https://chanakyanipothi.com/winning-strategy-for-gold-trading-tomorrow/>  
<https://chanakyanipothi.com/rupee-dollar-exchange-rate-guidance/>  
<https://chanakyanipothi.com/whatsapp-group/>